

## કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ દ્વારા જળ શક્તિ અભિયાન-૨૦૨૧નો પ્રારંભ કરવામાં આવ્યો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલીયા ફાર્મ, દાહોદ દ્વારા “જળ શક્તિ અભિયાન-૨૦૨૧” નો પ્રારંભ તારીખ ૦૬.૦૫.૨૦૨૧ ના રોજ વર્ચ્યુલ (ONLINE) માધ્યમથી કૃષિ ગોષ્ઠી નું આયોજન કરી કરવામાં આવેલ. આ કાર્યક્રમની શરૂઆત ડૉ. એચ. એલ. કાયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા (ઇ/યા), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આકૃયુ, દાહોદ દ્વારા જોડાયેલ તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કરવામાં આવેલ. શ્રી. જે. જે. પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા) દ્વારા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા સંબોધન કરેલ ત્યારબાદ ડૉ. એચ. એલ. કાયાએ કૃષિમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા “ઘરનું પાણી ઘરમાં”, “ખેતરનું પાણી ખેતરમાં” “સીમનું પાણી સીમમાં” અને “ગામનું પાણી ગામમાં” સંચય થાય તે વિષે સમજ આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ડૉ. ટી. એમ. ભરપોડા, નિવૃત્ત પ્રાધ્યાપક, ક્રિટિકશાસ્ત્ર વિભાગ, આકૃયુ, આણંદ દ્વારા જીલ્લાના ખેડૂતો વધારેમાં વધારે ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરે તે અંગે ખેડૂતોને તાકીદ કર્યા હતા. શ્રી. દીલીપભાઈ ધંગા, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, આકૃયુ, આણંદના સભ્ય અને પ્રગતીશીલ ખેડૂત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદની કામગીરેની પ્રશંસા કરી હતી અને ખેડૂતો વધારેમાં વધારે ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવે એ બાબાતે જણાવેલ ત્યારબાદ કેન્દ્રના વૈજ્ઞાનિક (પાક સરક્ષણ) શ્રી. એન. કે. રાહોડએ ભૂગર્ભ ટાંકીઓ બનાવી વરસાદી પાણીનો પીવા માટે સંગ્રહ કરવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવેલ જેના ઉકેલ અને સમજ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જી. કે. ભાભોર, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૬૧ ખેડૂતભાઈઓ/ગ્રાંસેવકો/વિસ્તરણ અધિકારીશ્રીઓ/આત્મા પ્રોજેક્ટના એટીએમ/બીટીએમશ્રીઓએ આ web કૃષિ ગોષ્ઠીમાં ભાગ લીધેલ હતો.

